

M.Com Semester - 2 (CBCS) Examination**May/June-2021 (NEW COURSE)****Corporate Financial Reporting (CORE COURSE)****Time: 1:30 Hours****Marks: 42****Instructions:**

1. Figure to the right indicate marks.
2. There are five questions in the question paper.
3. Answer any three of the following questions.

પ્રશ્ન-૧ A. નાણાકીય અહેવાલ પ્રેષણ જુદા જુદા ઉપયોગકર્તાની ચર્ચા કરો. (૧૪)

B. કંપનીલક્ષી નાણાકીય અહેવાલ પ્રેષણના હેતુઓ વર્ણવો.

પ્રશ્ન-૨ કિયા લિમી. નું નીચેના પાકા સરવૈયાના આધારે સમાન કદનું નાણાકીય પત્રક તૈયાર કરો. (૧૪)

મૂડી-દેવાં	31-03-19	31-03-20	મિલકત-લેણાં	31-03-19	31-03-20
ઇક્વિટી શેરમૂડી	4,00,000	5,00,000	જમીન મકાન	2,00,000	3,50,000
પ્રેફરન્સ શેર	1,00,000	2,00,000	ચંત્રો	1,50,000	2,50,000
સામાન્ય અનામત	1,00,000	1,50,000	ફર્નિચર	50,000	1,50,000
ન.નું. ખાતું	50,000	1,00,000	રોકાણો	1,50,000	1,50,000
૧૦% ડીબેન્યર	1,00,000	1,00,000	દેવાદારો	2,50,000	2,00,000
લેણદારો	1,50,000	2,00,000	આખર સ્ટોક	1,50,000	1,75,000
ખર્ચાનીચુકવણી બાકી	1,00,000	50,000	રોકડ	50,000	25,000
	10,00,000	13,00,000		10,00,000	13,00,000

પ્રશ્ન-૩ એપલ કંપનીનું તા.31-03-2019નાં રોજનું પાકુ સરવૈયુ નીચે પ્રમાણે છે. (૧૪)

જવાબદારીઓ	રૂ.	મિલકતો	રૂ.
ઇક્વિટી શેરમૂડી	5,00,000	કાયમી મિલકતો	6,00,000
અનામતો	2,00,000	સ્ટોક	1,00,000
તારણવાળી લોન	2,00,000	દેવાદારો	2,00,000
લેણદારો	1,00,000	રોકડ - બેંક	1,00,000
	10,00,000		10,00,000

વર્ષ 2019-20 દરમિયાન કુલ ખરીદ - વેચાણ અને સંચાલનખર્ચા અનુક્રમે રૂ.5,00,000, રૂ.8,00,000 અને રૂ.1,00,000 હતાં.

કાયમી મિલકતો પર 10% લેખે ઘસારો ગણાય છે. તા.31-03-2020 નાં રોજ સ્ટોક રૂ.1,60,000, દેવાદારો રૂ. 2,50,000, લેણદારો રૂ.1,20,000 અને રોકડસિલક રૂ.2,70,000 હતાં.

સામાન્ય ભાવ સપાટીના આંક નીચે મુજબ હતાં.

તા. 31-03-2019 નાં રોજ 400

તા. 31-03-2020 નાં રોજ 600

વર્ષ 2019-20 સરેરાશ 480

ઉપરથી માહિતિને આધારે ઐતિહાસિક પડતર પદ્ધતિ મુજબ તેમજ વર્તમાન ખરીદશક્તિ (CPP) પદ્ધતિ

મુજબ ભાવ સપાટીમાં થયેલાં ફેરફારની અસર આપી વાર્ષિક હિસાબો તૈયાર કરો.

પ્રશ્ન-૪ કાનજી લિમી.નું આવક-ખર્ચ પત્રક નીચે મુજબ છે. (૧૪)

વિગત	Rs.	Rs.
વેચાણ	40,00,000	
વ્યાજ	4,50,000	44,50,000
બાદ: માલસામાન પડતર	7,50,000	
પગાર અને મજૂરી	5,10,000	
વીમા પ્રીમિયમ	95,000	
ઓડીટ ફી	45,000	
પ્રિન્ટીંગ અને સ્ટેશનરી	15,000	
પાવર અને ફ્યુલ	2,25,000	
ભાડું અને કરવેરા	24,000	
ઘસારો	1,25,000	
લોનનું વ્યાજ	55,500	18,44,500
		26,05,500
બાદ: GST	50,000	
આવકવેરો	7,00,000	7,50,000
		18,55,500
બાદ: સામાન્ય અનામતમાંથી બદલી	5,01,500	
સુચિત ડિવિડન્ડ	2,54,000	7,55,500
રાખી મુકેલ કમાણી		11,00,000

ઉપરોક્ત માહિતીને આધારે મૂલ્ય વૃદ્ધિ પત્રક તૈયાર કરો.

પ્રશ્ન-૫ ટ્રેકનોંધ લખો.(કોઈપણ બે)

(૧૪)

1. નાણાકીય અહેવાલના ફાયદા
2. નાણાકીય પત્રકના હેતુઓ
3. કિંમત બદલાની ખ્યાલ અને સ્વરૂપ
4. બજાર મૂલ્ય વૃદ્ધિના ખ્યાલો

ENGLISH VERSION

Q.1 A. Discuss the various users of financial reporting (14)

B. Explain objectives of Corporate financial reporting

Q.2 Prepare common size financial statement for balance sheets of Kia Ltd. As under (14)

Liability	31-03-19	31-03-20	Assets	31-03-19	31-03-20
Equity share cap.	4,00,000	5,00,000	Land& Buildg.	2,00,000	3,50,000
Pref. share capital	1,00,000	2,00,000	Machinery	1,50,000	2,50,000
General reserve	1,00,000	1,50,000	Furniture	50,000	1,50,000
P & L Account	50,000	1,00,000	Investments	1,50,000	1,50,000
10% debentures	1,00,000	1,00,000	Debtors	2,50,000	2,00,000
Creditors	1,50,000	2,00,000	Closing stock	1,50,000	1,75,000
O/S Expenses	1,00,000	50,000	cash	50,000	25,000
	10,00,000	13,00,000		10,00,000	13,00,000

Q.3 Following is the balance sheet of Apple company as on 31-03-2019. (14)

Liabilities	Rs.	Assets	Rs.
Equity Share Capital	5,00,000	Fix assets	6,00,000
Reserves	2,00,000	Stocks	1,00,000
Mortgage loan	2,00,000	Debtors	2,00,000
Creditors	1,00,000	Cash – bank	1,00,000
	10,00,000		10,00,000

During year 2019-20 total purchase, sale and administrative expenses are Rs.5,00,000, Rs. 8,00,000 and Rs. 1,00,000 each respectively.

Calculate 10% depreciation on fix assets, Rs1,60,000 is stock, Rs. 2,50,000. Is debtors, Rs. 1,20,000 is creditors and Rs. 2,70,000 is on cash on hand as on Dt. 31-03-2020.

Normal Price base index is as follows:-

Dt. 31-03-2019 400

Dt. 31-03-2020 600

Average of year 2019-20 480

Use above information and prepare find accounts as per historical cost method and current purchasing power method. (CPP).

Q.4 Following is the statement of income and expenditure of Kanji ltd. (14)

Particularar	Rs.	Rs.
Sales	40,00,000	
Interest	4,50,000	44,50,000
Less: Material Cost	7,50,000	
Salaries and wages	5,10,000	
Insurance premium	95,000	
Audit fees	45,000	
Printing & Stationary	15,000	
Power & Fuel	2,25,000	
Rent and taxes	24,000	
Depreciation	1,25,000	
Interest on loan	55,500	18,44,500
		26,05,500
Less: Goods and service tax	50,000	
Income tax	7,00,000	7,50,000
		18,55,500
Less: Transferred to general Reserve	5,01,500	
Proposed Div.	2,54,000	7,55,500
Retained Earnings		11,00,000

Prepare value added statement from the above information.

Q.5 Write short Notes (Any two) (14)

1. Advantages of Financial reporting
2. Objective of financial statement
3. Nature and concept of price changes
4. Concept of market value added
